

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦
તા.૧૧/૦૮/૨૦૧૮ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૪૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૦ કેસ કરી, ૪૧ વ્યક્તિઓને ઝડપી, ૨૦૩ લીટર દેશી દારૂ, ૧૧૪૬ બોટલ ઇંગ્લીશ દારૂ, ૩૬૧ ક્વોટર ઇંગ્લીશ દારૂ, ૨૦ બિયર ટીન અને ૧ રીક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૧ કેસ કરી ૦૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૬,૭૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૪૨/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૦૮ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૫૪૩/૧૮

વટવા : કમલસિંહ અટલબિહારી કટારીયા ઉ.વ.૨૯ રહે, સવિતાનગર આશાપુરી રેસીડેન્સી સામે વટવા) એ તા.૯/૮/૧૮ નારોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૪/૧૮ ના કલાક ૯/૦૦ વાગ્યાના સુમારે આરોપી ધર્મેન્દ્ર ભીખાભાઈ વિક્રલાપરા (રહે, કુશ-૦૨ અયોધ્યા એપાર્ટમેન્ટ ગામડી રોડ વટવા) એ વટવા મંથન ટેનામેન્ટ મહાલક્ષ્મી તળાવ ખાતેથી રૂપિયા ૧૦૦૦/- ભાડા પેટે નક્કી કરી કમલસિંહની ટોયટો કંપની ની ફોર વ્હીલ ગાડી નંબર જીજી.૧૮.એ.એક્સ.૨૭૧૫ કિંમત રૂપિયા ૬,૧૬,૦૦૦/- લઈ જઈ પરત નહીં કરી, કમલસિંહ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.પી.ગોહિલ ચલાવે છે.

લુંટ ની ફરીયાદ :-

સમાચાર યાદી નં.૧૫૪૪/૧૮

માધવપુરા : જતીનભાઈ સ/ઓ ભરતભાઈ પંચાલ (ઉ.વ.૨૫)(રહે, ભક્તિનગર આઇ.ઓ.સી રોડ ચાંદખેડા) એ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૮/૧૮ સવારના ૫/૩૦ થી ૬/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન જતીનભાઈને ચાંદખેડા જવાનું હોઇ કાલુપુર રેલ્વે સ્ટેશન થી ઓટોરિક્ષામાં બેસી નમસ્તે સર્કલ પાસે બ્રીજની નીચે, મુસાસુહા કબ્રસ્તાનની બાજુમાં રોડની સાઇડમાં રીક્ષા ચાલકે રીક્ષા ઉભી રાખી, રિક્ષાનો ચાલક તથા તેમા બેસેલ અન્ય બે અજાણ્યા ઇસમો (તમામ ૨૫ થી ૩૦ વર્ષ આશરના) ભેગામળી જતીનભાઈ ને ચાકુ બતાવીને તેમનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- અને તેમની પાસેની બેગ કે જેમા જીઓ કંપનીનું ડોગલ, સીમકાર્ડ, પેનડ્રાઇવ, ઓટીજી કેબલ, આધારકાર્ડ તથા રોકડ રૂપિયા ૫૦૦/- અને ત્રણ જોડી કપડા મુકેલ હતા તેની લુંટ કરી, જતીનભાઈને રીક્ષામાંથી નીચે ઉતારી ત્રણેય ઇસમો નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.એન.દેસાઇ ચલાવે છે.

પાલડી : તસ્લમિ મુર્તુજા જરીવાલા (રહે,અલીફ એપાર્ટમેન્ટ ફીરદોશ ફલેટની બાજુમાં ખાનપુર) તા.૯/૮/૧૮ બપોરના ૩/૨૦ વાગ્યાના સુમારે પાલડી શાલીમાર કોમ્પ્લેક્સ સામે પેટાગોન મર્લીન આગળ રોડ ઉપર થી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ તસ્લમિ ના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ તસ્લમિ જરીવાલાએ તા.૧૦/૮/૧૮ નારોજ પાલડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી દિનેશભાઈ વાલજીભાઈ ચલાવે છે.

એલીસબ્રીજ : કૃપાબહેન w/o જયકુમાર ત્રિવેદી (ઉ.વ.૩૯)(રહે.કલા રેસીડેન્સી રેડીચો મીર્યા ટાવર પાસે સેટેલાઇટ) તા.૫/૮/૧૮ રાતના ૧૦/૪૫ વાગ્યાના સુમારે લો-ગાર્ડન બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડની પાસે ફેન્ડસ વિલા બિલ્ડીંગની સામે રોડ ઉપર થી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ ઉપર આવેલ પુરૂષ કૃપાબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ કૃપાબહેન ત્રિવેદી એ તા.૧૦/૮/૧૮ નારોજ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.ડી.પરમાર ચલાવે છે.

ઘાટલોડીયા : વસંતીબેન બળદેવભાઈ સાદરીયા (ઉ.વ.૫૬)(રહે,સ્વામી અખંડાનંદ સોસાયટી, મધુવુંદ સોસાયટી ની બાજુમાં નીલકંઠ મહાદેવ રોડ ઘાટલોડીયા) તા.૧૦/૮/૧૮ ના કલાક ૯/૧૫ વાગ્યાના સુમારે પોતાની સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક્ટીવા ઉપર આવેલ પુરૂષ વસંતીબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ વસંતીબહેન સાદરીયા એ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એન.પરમાર ચલાવે છે.

આત્મહત્યા :-

શહેરકોટડા : ફિરોજા ડો/ઓ નાસીરભાઈ ધાંચી (ઉ.વ.૧૭)(રહે,જાલમપુરી ની ચાલી ડી/૨૨ દવાખાના ની સામે સરસપુર) એ અગમ્ય કારણસર તા.૧૦/૮/૧૮ સાંજના ૭/૪૫ વાગ્યા પહેલા કોઇપણ સમયે પોતાના ઘરે લોખંડ ની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અક્સ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી હમીરભાઈ અળશીભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.